

Dr. Babasaheb Ambedkar Open University
Term End Examination July -2026

Course : B.Com.
Subject Code : ECO-04
Subject Name : નામા પદ્ધતિ-2

Date : 15/07/2026
Time : 11:30am to 01:45pm
Duration : 02.15 Hours

Max. Marks : 70

પ્રશ્ન-1 રાવલ એન્ડ સન્સના મકાનમાં 15 ઓક્ટોબર, 1995 ના રોજ આગ લાગી. નીચેની માહિતીના આધારે નાશ પામેલા માલ અંગે થયેલા નુકસાનની રકમ શોધો અને વીમા કંપની સમક્ષ રજૂ કરવાના દાવાની રકમ ગણો:

	રૂ.
1-1-94 નો સ્ટોક	30,600
1-1-94 થી 31-12-94 સુધીની ખરીદી	1,22,000
1-1-94 થી 31-12-94 સુધીનું વેચાણ	1,80,000
31-12-94 નો સ્ટોક	27,000
1-1-95 થી આગ લાગ્યા તારીખ સુધીની ખરીદી	1,47,000
1-1-95 થી આગ લાગ્યા તારીખ સુધીનું વેચાણ	1,50,000
સ્ટોકની કિંમત પડતરના 90% પ્રમાણે ગણવામાં આવતી હતી. બચાવેલા માલની કિંમત રૂ. 18,000 આંકવામાં આવી હતી. વીમા પોલિસીની રકમ રૂ. 63,000 હતી અને તેમાં સરેરાશ કલમ સામેલ હતી.	

અથવા

ભાડે ખરીદનારનાં હક્કો વિશે ચર્ચા કરો.

પ્રશ્ન-2 X અને Y પેઢીનું 31 ડિસેમ્બર, 1989 ના રોજનું પાકું સરવૈયું નીચે આપવામાં આવ્યું છે: 14

જવાબદારીઓ	રૂ.	મિલકતો	રૂ.
મૂડી:		મકાન	50,000
X	60,000	યંત્રો	45,000
Y	30,000	પરચૂરણ દેવાદારો	11,600
પરચૂરણ લેણદારો	25,000	રોકડ	8,400
	1,15,000		1,15,000

તેમણે Z ને નફામાંથી $\frac{1}{4}$ ભાગ આપવાની શરતે તા. 1 જાન્યુઆરી, 1990 ના રોજ ભાગીદારીમાં દાખલ કર્યો. પેઢીની પાઘડીની કિંમત રૂ. 36,000 આંકવામાં આવી. પેઢીના ચોપડામાં પાઘડી ખાતું ઊભું કરવાનું છે. X અને Y તેમની મૂડીના પ્રમાણમાં નફો-નુકસાન વહેંચતા હતા. Z એ તેની મૂડી તરીકે રૂ. 25,000 રોકડમાં લાવવાના હતા. જરૂરી આમનોંધો લખી અને નવી પેઢીનું પાકું સરવૈયું તૈયાર કરો.

અથવા

નાણાકીય પત્રકોની મર્યાદાઓ સમજાવો.

અથવા

નીચેના પાકા સરવૈયા ઉપરથી કાર્યશીલ મૂડીમાં ફેરફાર દર્શાવતું પત્રક તૈયાર કરો.

જવાબદારીઓ	1-1-95 (રૂ.)	31-12-95(રૂ.)	મિલકતો	1-1-95(રૂ.)	31-12-95(રૂ.)
મૂડી	67,200	1,18,000	કાયમી મિલકતો	60,000	1,14,200
ચાલુ દેવા			ચાલુ મિલકતો		
ધંધાના લેણદારો	28,700	31,000	દેવાદારો	45,500	50,000
ઓવરડ્રાફ્ટ	33,500	32,000	સ્ટોક	40,000	36,800
દેવી હૂંડી	43,000	44,000	અગાઉથી ચૂકવેલા ખર્ચા	27,600	20,000
ચૂકવવાનો કર	27,600	25,000	બેંક સિલક	26,900	29,000
	2,00,000	2,50,000		2,00,000	2,50,000

પ્રશ્ન-4 ઓડિટના હેતુઓ વિશે વિસ્તૃતમાં જણાવો.

14

અથવા

રોકાણોની ચકાસણી અને મૂલ્યાંકન કરતી વખતે ઓડિટરે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ?

પ્રશ્ન-5 ટ્રેકનોંધ લખો. (ગમે તે બે)

14

1. આંતરિક ઓડિટ
2. ભાગીદારી ઓડિટ અને કંપની ઓડિટ વચ્ચેનો તફાવત
3. ગુણોત્તરોનું વર્ગીકરણ
4. શેર જપ્તી
5. પાઘડીના મૂલ્યાંકનની સરેરાશ નફાની પદ્ધતિ
